

PART PLAN OF DRAFT
TOWN PLANNING SCHEME NO:229(JASAPUR - KHODIYAR)

FINAL PLOT NO: 395/1
ORIGINAL PLOT NO: -




SCALE:1C.M.=20.0M.



LEGEND

 O.P BOUNDARY
 F.P BOUNDARY



This part plan is certified for the F.P NO: 395/1

Sanctioned Under Govt. Notification No:
GH/V/213 of 2014/ TPS-112013-2621-L; Dt. 24-12-2014.

- NOTE:-**
- Final plots boundary and allotment of final plot as subject to variation
 - This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition/Alteration.

TRUE COPY

PREP. BY : 
CHD. BY : 

H. D' MANI

Assistant Town Planner
Ahmedabad Urban Development Authority
Ahmedabad.


DISTRICT:- AHMEDABAD


$$1 \text{ cm} = 80.00 \text{ m}$$

LEGEND

-  Residential Zone III-R3
 RESIDENTIAL AFFORDABLE HOUSING ZONE-RAH
 Existing Road
 Proposed Road
 TPS Boundary

Part Plan of Sanctioned Development plan (Second Revised) of AUDA Under Govt. Notification no. GH/V/207 of 2014/DVP-112013-4777-L Dated-20/12/2014 U/S -17(1)(c) of the G.T.P. & U.D. Act-1976



This part plan is certified for the BLOCK NO :- 194

NOTE :- This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as Development Permission or Permission for Addition/Alteration.

Prep. By:

Chd. By:

H. D' man:

Date: 21-08-2020

Receipt No:2176

TRUE COPY

Assistant Town Planner

**Ahmedabad Urban Development Authority
Ahmedabad.**



અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪.
ફોન નં.: ૨૭૫૪૫૦૫૧, ૨૭૫૪૫૦૫૨, ૨૭૫૪૫૦૫૪



ઔડાની વેબ સાઈટ : www.auda.org.in

- ઔડાની વિકાસ યોજના.
- માળખાકીય સુવિધાઓ. (INFRASTRUCTURE)
- સામાજિક સેવાઓની યોજનાઓ.

હવે વિવિધ માહિતી ઉપલબ્ધ છે, - જેવી કે...

- નગર રચના યોજનાઓ. (ટી.પી.સ્કીમ)
- પર્યાવરણલક્ષી યોજનાઓ
- અન્ય પ્રોજેક્ટ

અરજી નંબર _____
પહોંચ નંબર ૨૧૭૬

ઝોનીંગ સર્ટીફિકેટ

તા.: ૨૧-૦૮-૨૦૨૦

પ્રતિ શ્રી, શ્રી જી.પી.ભાઈ પટેલ

વિષય : વિકાસ યોજના ૨૦૨૧ ના ઝોનીંગ સર્ટીફિકેટ અંગે.

સંદર્ભ : આપશ્રીની તા. ૨૧-૦૮-૨૦૨૦ ની અરજી અન્વયે

ઉપરોક્ત વિષયે મોજે શ્રી ડિવાર તાલુકો દસક્રીઈ બ્લોક નં./સર્વે નં. ૧૮૪ _____ ની જમીન

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની કલમ ૧૭ (૧) (ક) હેઠળ તા. ૨૦-૧૨-૨૦૧૪ના રોજ રાજ્ય સરકાર શ્રી એ મંજૂર કરેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ નકશાની દરખાસ્ત મુજબ સદરહુ જમીનમાંથી _____ ૨૪.૦૦ બી

ના રોડની કપાત થાય છે. બાકીનો ભાગ ડિસ્ટ્રિક્ટ રોડ-III-૧૩ બાજુ/બાજુના સાવર પ્રો. ડિસ્ટ્રિક્ટ રોડ સાઈડેલ કાંડ નં. ૦૧-૨૫૫ સાથે _____

ઝોનમાં આવે છે.

૧. સદરહુ જમીન _____ ટી.પી. સ્કીમ નં. ૨૨૮ (સાસપુર-શ્રી ડિવાર) ફાઈટ બંક્સ તથા _____ ના વિસ્તારમાં આવતી હોવાથી

તેને ટી.પી. સ્કીમ હેઠળ અન્ય દરખાસ્તો - જોગવાઈઓ ફેરફાર ને પંધનકર્તા રહેશે.

૨. દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજનાની દરખાસ્તો સરકાર શ્રી ને આધીન ફેરફારને પાત્ર રહેશે.

નોંધ : "આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે
બાંધકામની પરવાનગી નથી"

CHD BY: [Signature]
CHD MAN: [Signature]



મદદનીશ નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ